



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૧૦/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૨૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૦ કેસ કરી, ૭૧ વ્યક્તિઓને ઝડપી, ૨૦૧ લીટર દેશી દારૂ, ૨૨૯ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૧૧ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૪૪ બિયર ટીન અને ૨ સ્ફટક કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૧૫ વ્યક્તિઓની અટક કરી રોકડ રૂપિયા ૧૬,૬૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૨૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૦૨૯/૧૮

નિકોલ: લીલાબહેન રાજુભાઈ પ્રજાપતિ (રહે. શક્તિનગર સોસાયટી વિદ્યાનિકેતન સ્કુલ સામે ખોડીયારનગર રોડ નિકોલ) એ તા.૧૬/૧૦/૧૮ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૧૦/૧૮ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે બે અજાણ્યા પુરૂષ (૨૧ થી ૩૦ વર્ષ ના આશરાના) ભેગામળી લીલાબહેન ને કહેલ કે “અમો ભુખ્યા છીએ જમવા માટે પૈસા આપો” તેમ કહી લીલાબહેન પાસેથી બસો ત્રણસો રૂપિયા માંગેલ, જે પૈસા બાબતે, લીલાબહેને ના પાડતા, બોલાચાલી કરી, લીલાબહેને “અમારી પાસે એક લાખ રૂપિયાનું પડીકું છે તમને રાખવા માટે આપીએ છીએ અને તમે પહેરેલ દાગીના તથા પૈસા અમોને આપી દો” તેમ કહી લીલાબહેને લાલચ આપી, તેમના કાનની સોનાની બુટી, કાન શેર તથા લટકણીયા ઝુમર મળી કુલ રૂપિયા ૨૦,૦૦૦/- મતાના તેમજ રોકડ રૂપિયા ૧,૫૦૦/- મળી કુલ રૂપિયા ૨૧,૫૦૦/- મતા લઈ જઈ લીલાબહેન સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.વી.પટેલ ચલાવે છે.

અમરાઈવાડી: ગુડ્ડનભાઈ મહેશચંદ્ર વાજ્પેયી (રહે.કર્મયોગ-૨ તક્ષશીલા સ્કુલ પાસે ઓઢવ) એ તા.૧૬/૧૦/૧૮ નારોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૭/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) રાજુભાઈ સુરેશભાઈ પ્રજાપતિ (રહે.શીતલ છાયા અર્બુદાનગર ઓઢવ) અને (૨) સુખદેવભાઈ રામનરેશ પ્રજાપતિએ ભેગા મળી અમરાઈવાડી રબારી કોલોની ચંદ્રાવતી એસ્ટેટ બોબી એજીન્સીરીંગ વર્કસ ખાતે આરોપી રાજુભાઈ, ગુડ્ડનભાઈના કારખાને સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હોઈ, તેઓએ ગુડ્ડનભાઈની સહીવાળા બીલ તેમજ લેટરપેડનો દુરઉપયોગ કરી કાચો માલ રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- ખરીદ કરી સસ્તા ભાવે બારોબાર વેચાણ આપી, છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.એચ.મકવાણા ચલાવે છે.

સોનાનુ મંગળસુત્ર/ સોનાની ચેઈન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૦૩૦/૧૮

વસ્ત્રાપુર: બાબુભાઈ નનુભાઈ સંઘાણી (ઉ.વ.૬૮) (રહે.સુખનાથ મંદીરની બાજુમા સુખનાથ પરા લીલીયા રોડ અમરેલી) તા.૧૬/૧૦/૧૮ રાતના ૮/૧૫ વાગ્યાના સુમારે સ્ટર્લીંગ હોસ્પીટલ બહાર ત્રણ રસ્તા કોર્નર ઉપર આવેલ જ્યુસની લારી ઉપર બાબુભાઈ તથા તેમની પત્ની ઉભા હતા દરમ્યાન મોટર સાયકલ ઉપર આવેલ અજાણ્યો પુરૂષ નજીક આવી, બાબુભાઈની પત્નીના ગળામાંથી સોનાનો દોરો કિમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ બાબુભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.જે.રાણા ચલાવે છે.

શહેરકોટડા: અંબાબહેન વા/ઓ જયંતીભાઈ સોલંકી (ઉ.વ.૬૦)(રહે.વિજય કામદાર સોસાયટી પ્રભાકર ટેનામેન્ટની બાજુમાં સૈજપુર બોધા) તા.૧૬/૧૦/૧૮ કલાક ૦૦/૦૫ વાગ્યાના સુમારે નરોડા ક્રુટ માર્કેટ બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ પાસે આવેલ શૌચાલય નજીકથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ અંબાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ અંબાબહેન સોલંકીએ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.ડી.કલારા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૦૩૧/૧૮

નિકોલ: નીતાબહેન ડો/ઓ ઝીણાભાઈ સોલંકી (ઉ.વ ૩૮) (રહે. રણજાનગર સોસાયટી ખારીકટ કેનાલ પાસે ગાયત્રી સ્કુલ પાછળ) એ બિમારીથી કંટાળી તા.૧૬/૧૦/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે હુકમાં કપડું બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી જલપાબેન દિપકકુમાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.